



RAN-1801130701010001

M.A. (Economics) (Sem. - I) Examination November - 2025

Micro Economics - I (Paper : CC-01)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નં. 1 ફરજિયાત છે.
- (3) પ્રશ્ન નં 4 માં કોઈપણ બે ટૂંકનોંધ લખો.
- (4) પ્રત્યેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવ્યા છે.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નનાં ટૂંકમાં જવાબ આપો :

(10)

1. જોખમ પરત્વે વ્યક્તિના વર્તનની અપેક્ષિત તૃષ્ટિગુણ આધારિત વ્યાખ્યા જણાવો.
2. ઈષ્ટતમ સાધન સંયોજન એટલે શું?
3. ગ્રાહકની સમતુલા એટલે શું?
4. જો પૂર્ણ હરિક્ષાઈમાં પેઢીની સરેરાશ આવક કરતાં સરેરાશ ખર્ચ વધુ હશે તો પેઢીને શું મળશે?
5. જોખમ અને અનિશ્ચિતતા વચ્ચેનો તફાવત જણાવો.

પ્ર. 2. ઘટતા જતા સીમાંત તૃષ્ટિગુણના નિયમના આધારે માંગરેખાની ચર્ચા કરો.

(13)

અથવા

પ્ર. 2. કોબ-ડગ્લાસ ઉત્પાદન વિધેય એટલે શું? તેની મુખ્ય લાક્ષણિકતાઓ, ઉપયોગિતા અને મર્યાદા સમજાવો.

પ્ર. 3. કિંમત ભેદભાવ એટલે શું? ભેદભાવયુક્ત ઈજારામાં પેઢીની સમતુલા સમજાવો.

(13)

અથવા

પ્ર. 3. જોખમ અને અનિશ્ચિતતા એટલે શું? જોખમની માપણીની પદ્ધતિઓને મર્યાદા સહિત સમજાવો.

પ્ર. 4. ટૂંક નોંધો લખો (કોઈપણ બે)

(14)

1. ગ્રાહકની સમતુલાનો સિદ્ધાંત
2. ન્યૂનતમ ખર્ચ સંયોજન
3. ઈજારાના લક્ષણો
4. અસંમિત માહિતી

ENGLISH VERSION

Q. 1. Answer the following in brief.

(10)

1. State the expected satisfaction-based definition of a person's behaviour towards risk.
2. What is the optimal combination of factor?
3. What is cconsumer's equilibrium?
4. In perfect competition, if the average cost of a firm is greater than its average revenue, what will the firm get?
5. State difference between risk and uncertainty.

Q. 2. Discuss the demand curve based on the law of diminishing marginal utility. (13)

OR

Q. 2. What is Cobb-Douglas production function? Explain its main characteristics, importance and limitations of it. (13)

Q. 3. What is price discrimination? Explain the equilibrium of the firm under discriminatory monopoly. (13)

OR

Q. 3. What is risk and uncertainty? Explain the methods of measuring risk including their limitations. (13)

Q. 4. **Write short notes. (Any Two)** (14)

1. Theory of Consumer's Equilibrium.
 2. Least cost combination.
 3. Characteristics of Monopoly
 4. Asymmetric information
-